



જનસંપર્ક અધીકારી દ્વારા

પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર

ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩



કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૦૮/૦૬/૨૦૧૯ શનિવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગાર ધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૯૭૫/૧૯

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૬૯ કેસ કરી, ૫૪ વ્યક્તિઓને ઝડપી, ૪૭૯ લીટર દેશી દારૂ, ૩૫ બોટલ ઇંગ્લીશ દારૂ, ૨૯૬ બિયર ટીન અને ૧ સ્કૂટર કબજે કર્યું હતું. તેમજ જુગાર ધારા હેઠળ ૪ કેસ કરી ૧૧ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૨૮,૫૨૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૯૭૬/૧૯

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૧૦૮ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી ૯૩ મુજબ ૧ વ્યક્તિની અટકાયત કરી હતી.

વિશ્વાસઘાત અને છેતરપીંડી :-

સમાચાર યાદી નં.૯૭૭/૧૯

કારંજ: મહમદયુનુસ મહમદઇબ્રાહીમ પઠાણ (રહે. વનમાળી વાંકાની પોળ શાહપુર) એ તા.૭/૬/૧૯ નારોજ કારંજ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે માહે ઓક્ટોબર ૨૦૧૬ થી આજદીન સુધીના સમયગાળા દરમિયાન મીરજાપુર દિનબાઇ ટાવર સામે આવેલ શાંતિસદન એસ્ટેટમાં “ખુશ્બુ પાન પાર્લર ” નામના પાનના ગલ્લા પાસે આરોપી (૧) અલીહુશેનભાઇ ઉર્ફે બાદશાહ (૨) નાજમીનબાનુ વા/ઓ અલીહુશેનભાઇ ઉર્ફે બાદશાહ (બન્ને રહે. બુરખા પોસની મસ્જીદ શાહપુર) (૩) રાકેશભાઇ શથવારા ઉર્ફે પરમાર સાહેબ નામની વ્યક્તિ (૪) સાહીદ ઉર્ફે બાબા મનસુરી (રહે. રાજજીની પોળમાં શાહપુર અને (૫) સલીમભાઇ ફોરમેન (રહે. ખાનપુર કલ્યાણીવાડ શાહપુર) એ ભેગા મળી ઔડાના મકાન અપાવવાની લાલચ આપી મહમદયુનુસ પઠાણ તેમજ તેમના સબંધીને બોગસ ટોકન તથા નાણાં ભર્યા અંગેની બોગસ સહી સીકકાવાળી પહોચો તથા બોગસ હાઇકોર્ટનો પત્ર આપી કુલ નાણાં ૩૨,૪૮,૧૬૦/- મેળવી લઇ ઔડાના મકાનો નહી અપાવી તેમજ નાણા પણ પરત નહી આપી વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એસ.ડી.ચોધરી ચલાવે છે.

ઘરફોડ:-

સમાચાર યાદી નં.૯૭૮/૧૯

અમરાઈવાડી: ગોવિંદભાઇ બુધ્ધીલાલ અગ્રવાલ (રહે. નવીનચંદ્ર પાર્ક કેમ્પ રોડ શાહીબાગ) એ અમરાઈવાડી પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૬/૬/૧૯ રાતના ૯/૦૦ થી તા.૭/૬/૧૯ કલાક ૮/૩૦ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન અમરાઈવાડી સ્વસ્તિક ચાર રસ્તા પાસે આશાપુરીનગર-૨ કેલીબરજીમ ઇકવીપમેંટ નામના જીમના કારખાનાનું છતનું પતરું તોડી અજાણી વ્યક્તિ પ્રવેશ કરી મશીનમા લગાડવાના એલ્યુમીનીયમના પાર્ટ કિમત રૂપિયા ૧૫,૦૦૦/-, ડમ્બેલ્સ નંગ-૧૦ કિમત રૂપિયા ૭૦૦૦/-, સીલીંગ ફેન કિમત રૂપિયા ૧૦૦૦/-, ટુલ્સ બેગ કિમત રૂપિયા ૩૦૦૦/-, લોખંડ કાપવાનું ફાયર મશીન કિમત રૂપિયા ૧૨૦૦/- અને રોકડ રૂપિયા ૨૦,૦૦૦/- મળી કુલ રૂપિયા ૪૭,૨૦૦/- મતાની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એસ.આર.શર્મા ચલાવે છે.

સોનાની ચેઈન ખેચી તોડી લઈ ગયા:-

સમાચાર યાદી નં.૯૭૯/૧૯

ચાંદખેડા: સાવિત્રીબહેન વા/ઓ સુભાષ મીણા ઉ.વ.૪૭ રહે- અતિશય વિલે બંડ્લોઝ એચ.પી પેટ્રોલપંપ સામે મોટેરા) તા.૭/૬/૧૯ સવારના ૬/૩૦ વાગ્યાના સુમારે ચાંદખેડા મોટેરા પલાશ -૮૦ ફ્લેટ નજીકથી ચાલતા પસાર થઈ રહ્યા હતા ત્યારે એક મોટર સાયકલ ઉપર આવેલ બે પુરુષ સાવિત્રીબહેન મીણાના ગલામાંથી સોનાની ચેઈન કિંમત રૂપિયા ૨૫,૦૦૦/- ખેચી તોડી લઈ નાસી ગયા હતા. આ અંગેની ફરીયાદ સાવિત્રીબહેન મીણાએ ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી બી.કે.પટેલ ચલાવે છે.

આત્મહત્યા:-

સમાચાર યાદી નં.૯૮૦/૧૯

અમરાઈવાડી: સપનાબહેન વા/ઓ રાજીવકુમાર સરોજ (ઉ.વ.૨૩) (રહે. તુલશી બ્યુટી પાર્લર સામેના મકાનમા શાક માર્કેટ અમરાઈવાડી) એ અગમ્ય કારણસર તા.૭/૬/૧૯ સવારના ૯/૩૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે લોખંડના હુકમાં સાડી બાંધી ગળેફાસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે અમરાઈવાડી પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ પો.સ.ઈ.શ્રી એ.આર.ચૌધરી ચલાવે છે.

નિકોલ: મોહીતકુમાર સુરેશકુમાર અનુરાગી (ઉ.વ.૧૮) (રહે. રાધેગોવિંદ ગેલેક્ષી સામે આવેલ ખેતરમા નિકોલ) એ અગમ્ય કારણસર તા.૭/૬/૧૯ કલાક ૭/૪૫ વાગ્યાના સુમારે પોતાના ઘરે ગળેફાસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે નિકોલ પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ મ.સ.ઈ.શ્રી પ્રવિણભાઈ સાંજાભાઈ ચલાવે છે.

કૃષ્ણનગર: ભુમેદાભાઈ મનસુખભાઈ ગૌસ્વામી (ઉ.વ.૨૫) (રહે. ચિત્રકુટ આવાસ યોજના મનોહરવિલા) એ અગમ્ય કારણસર તા.૭/૬/૧૯ બપોરના ૪/૦૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે ગળેફાસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે કૃષ્ણનગર પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ વિજયકુમાર ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.